



سرکار
پنجاب

سرکار پنجاب کا سرکار: 2023-24ء کے لیے سرکار کے سرکار کے سرکار
سرکار کا سرکار: 004/2024
سرکار کا سرکار: AS-B/IU/2024/12

23/1/2024

سرکار کے سرکار
سرکار کے سرکار

ސަލާމަތު ދަލީ ސަލާމަތު ސަލާމަތު	
ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: 2023 ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު AS-B/IU/2024/12 2024 23 ސަލާމަތު ސަލާމަތު	
ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: " ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު " ސަލާމަތު: 2024 23 ސަލާމަތު 2023 29 ސަލާމަތު ސަލާމަތު	
ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: - ސަލާމަތު: - ސަލާމަތު: - ސަލާމަތު: - ސަލާމަތު:	
ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: ސަލާމަތު: ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު 7775660 procurement@aminiya.edu.mv	
ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު	
ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: 11:00 ސަލާމަތު: ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު 2024 01 ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: ސަލާމަތު ސަލާމަތު 11:00	
ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު: ސަލާމަތު: ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު ސަލާމަތު	

የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ	24.1
የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ -	28.1
የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ 30 (ወር)	28.2
የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ -	30.1
የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ -	36.1

ስዕሎች 2 - የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ

(ሀ) የግብርና አስተዳደር

1. የግብርና አስተዳደር
 - 1.1 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ
 - 2.1 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ (ግብርና አስተዳደር)
 - 2.1.1 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ
 - 2.1.2 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ
 - 2.1.3 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ
 - 2.1.4 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ
 - 2.2 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ
 - 2.3 የግብርና አስተዳደር የግብርና ገቢዎች ለፎንዳቤል ገቢዎች ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ ለፍታዊ ደረጃ

(ወ) ለገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።

16.3 ለገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።

16.3.1 ገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
እርግጠኛ (ጥሬ ገቢ 3 ወር ድረስ)

16.3.2 ገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
(ጥሬ ገቢ 3 ወር ድረስ)።

(ሀ) የገንዘብ ጥሬ ገቢ

17.1 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
የገንዘብ ጥሬ ገቢ

17.2 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።

17.3 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
የገንዘብ ጥሬ ገቢ

17.4 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
የገንዘብ ጥሬ ገቢ

18.1 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
የገንዘብ ጥሬ ገቢ

18.2 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
የገንዘብ ጥሬ ገቢ

18.3 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።

19.1 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
የገንዘብ ጥሬ ገቢ

የገንዘብ ጥሬ ገቢ
የገንዘብ ጥሬ ገቢ
የገንዘብ ጥሬ ገቢ
የገንዘብ ጥሬ ገቢ

(ሀ) የገንዘብ ጥሬ ገቢ

20.1 የገንዘብ ጥሬ ገቢ ለማግኘት የሚያስፈልጉትን ስራዎች ይደግፉ።
የገንዘብ ጥሬ ገቢ

- 20.2. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
- 20.3. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
21. 21.1. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
- 21.2. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
22. 22.1. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
- 22.1.1. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
- 22.1.2. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
- 22.1.3. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
23. 23.1. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
24. 24.1. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
25. 25.1. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.
26. 26.1. مۆسىقىي ئىنستىتۇتتا مۆسىقىي تىل ئۆگەتكۈچىسىنىڭ مۇددىتىنى بەلگىلەش كېلىشىم نامى.

27.1 ጊዜ ጠቅላይ የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለገቢዎች ሪፖርት ለውጥ (ገቢዎች) ተገቢ ገቢዎች ለመሆን ማረጋገጥ ይገባል።

27.2 ገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

27.3 ገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

(ሀ) የሥራ ገቢዎች ሪፖርት

28.1 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

28.2 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

28.3 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

28.4 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

28.5 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

29.1 ገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

29.2 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

29.3 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

29.4 የገቢዎች ሪፖርት ላይ ተዘርዘሮ የሚገኝውን የገቢዎች ሪፖርት ለውጥ ለገቢዎች ሪፖርት ለውጥ ለመሆን ማረጋገጥ ይገባል።

රහස්‍යවත්ව පවත්වාගෙන යාම කළ යුතු බවට තීරණය වූ බැවින් සභාවේ සාමාජිකයන්ගේ විවිධ අදහස් පිරිසිදු කිරීම සඳහා 9 වන කොටස.

29.5. එමගින් නව කොටසක් සම්බන්ධයෙන් කටයුතු වන බවට තීරණය වූ බැවින් 15% (පිරිසිදු කිරීම) සඳහා වරදක් (වරදක්) කරනු ලැබූ බැවින් එයට අදාළව ආදායම් පත්‍රයක් නිකුත් කළ යුතු බවට තීරණය වූ බැවින්.

30.1. වරදක් කරනු ලැබූ බැවින් 250,000/- රුපියලකට වටිනාකමක් ඇති භාණ්ඩ පිරිසිදු කිරීම සඳහා වරදක් කරනු ලැබූ බැවින්.

30.2. වරදක් කරනු ලැබූ බැවින් භාණ්ඩ පිරිසිදු කිරීම සඳහා වරදක් කරනු ලැබූ බැවින් ආදායම් පත්‍රයක් නිකුත් කළ යුතු බවට තීරණය වූ බැවින්.

30.3. වරදක් කරනු ලැබූ බැවින් ආදායම් පත්‍රයක් නිකුත් කළ යුතු බවට තීරණය වූ බැවින්.

31.1. වරදක් කරනු ලැබූ බැවින් 17.09 වන කොටසේ සඳහන් කර ඇති ආදායම් පත්‍රයක් නිකුත් කළ යුතු බවට තීරණය වූ බැවින්.

K/CIR/2018/01 හි 17 වන කොටසේ දැනට වරදක් කරනු ලැබූ බැවින්.

31.2. වරදක් කරනු ලැබූ බැවින් 17.09 වන කොටසේ සඳහන් කර ඇති ආදායම් පත්‍රයක් නිකුත් කළ යුතු බවට තීරණය වූ බැවින්.

3 - ספר שמי

הוראות כלליות לשימוש בפרק זה

- 33.1. **33.33. וְשֵׁרְטָנִים** "ואשר יהיו וְשֵׁרְטָנִים" נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
33.2. "ואשר יהיו וְשֵׁרְטָנִים" נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
33.3. "ואשר יהיו" נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
33.4. "ואשר יהיו וְשֵׁרְטָנִים" נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
33.5. "ואשר יהיו" נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
34.1. **34.34. וְשֵׁרְטָנִים** וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
34.35. וְשֵׁרְטָנִים וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
34.2. וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
34.3. וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
35.1. **35.35. וְשֵׁרְטָנִים** וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
35.36. וְשֵׁרְטָנִים וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
35.2. **35.37. וְשֵׁרְטָנִים** וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
36.1. **36.38. וְשֵׁרְטָנִים** וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.
36.2. **36.39. וְשֵׁרְטָנִים** וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה, וְשֵׁרְטָנִים נאמר בפרק זה.

36.3 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 ለሰው ጤና ጉዳይ ማስፈራሪያዎች ማድረግ፡
 ለሰው ጤና ጉዳይ ማስፈራሪያዎች ማድረግ፡

37.1 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡

37 ለሰው ጤና ጉዳይ

37.2 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡

ጉዳይ

37.3 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡

38.1 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 10.71 ወይንም ሌላ ማስፈራሪያዎች ማድረግ፡

38 ጉዳይ

ጉዳይ

38.2 ጉዳይ ለ-2,500,000/ ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 0.005 (ጉዳይ ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡

ጉዳይ

ጉዳይ

$$CP \cdot 0.005 \cdot LD = \text{ጉዳይ ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡}$$

CP (ጉዳይ ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡)

LD (ጉዳይ ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡)

38.3 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡

38.4 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 15% ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡

39.1 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡
 ለሰው ጤና ጉዳይ የሚከተሉትን ማስፈራሪያዎች ማድረግ፡

39 ጉዳይ

ጉዳይ

הנהלת/דסקרטיון/דירקטוריון/דירקטור

מספרו/תקדומו/הנהלת/דסקרטיון/דירקטוריון/דירקטור

מספרו/תקדומו	מספרו/הנהלת/דסקרטיון/דירקטוריון/דירקטור	ת"מ
295 (ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור)	ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור	1

1- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

2- 295 ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור. ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור. ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור. ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

3- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

4- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

5- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

6- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

7- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

8- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

9- ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור, ת"מ/דסקרטיון/דירקטוריון/דירקטור.

Trophy Details for Prize Winners 2022·2023

#	Prize	Number	Height
1	Honour Listed	11	25 cm
2	General Proficiency	25	23 cm
3	Class Prize	14	20 cm
4	Subject Prize	115	20 cm
6	Top Achiever Award (National Top 10)	27	27 cm
7	Top Achiever Award (School Top 5)	8	27 cm
8	Distinction Award	55	25 cm
9	Higher Distinction Award	26	25 cm
10	Brilliance Award	3	27 cm
11	Best Student in Studies from Uniform Bodies	4	25 cm
12	Best All Round Student from Uniform Bodies	4	27 cm
13	Best All Round Student - 1st	1	35 cm
14	Best All Round Student - 2nd	1	32 cm
15	Best All Round Student - 3rd	1	32 cm
Total		295	

٤ - السجلات

٥ - قوائم الحسابات

١ - قائمة

قوائم الحسابات والبيانات المالية للشركة

#	توضيح الحسابات
قوائم الحسابات والبيانات المالية للشركة	
1	قوائم الحسابات (٢ قوائم)
2	تقرير الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية
3	تقرير الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية
4	تقرير الميزانية العمومية (الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية)
5	تقرير الميزانية العمومية (٣ قوائم)
6	تقرير الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية
7	قوائم الحسابات (٢ قوائم)
8	6.1 قوائم الحسابات والبيانات المالية للشركة
9	٥ قوائم الحسابات (٥ قوائم)
قوائم الحسابات والبيانات المالية للشركة	
10	قوائم الحسابات والبيانات المالية للشركة (٥ قوائم)
11	٤ قوائم الحسابات (٤ قوائم)
قوائم الحسابات والبيانات المالية للشركة	
12	تقرير الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية / الميزانية العمومية
13	سجلات الحسابات (١٥ قوائم)
14	سجلات الحسابات (١٥ قوائم)
15	قوائم الحسابات (١٥ قوائم)
قوائم الحسابات والبيانات المالية للشركة	
16	قوائم الحسابات (٣ قوائم)
17	قوائم الحسابات (٣ قوائم)

٣ - مذكرات

مذكرات ومذكرات

١. مذكرات ومذكرات		
	مذكرات	-1.1
	مذكرات على مذكرات	-1.2
	مذكرات على مذكرات	-1.3
	مذكرات على مذكرات	-1.4
	مذكرات على مذكرات	-1.5
	مذكرات على مذكرات	-1.6
	مذكرات على مذكرات	-1.7
	مذكرات على مذكرات	-1.8
٢. مذكرات ومذكرات (مذكرات ومذكرات) مذكرات ومذكرات		
#	مذكرات	مذكرات
	مذكرات	مذكرات
	مذكرات	مذكرات
	مذكرات	مذكرات
٣. مذكرات ومذكرات		

تجوید - 4

تجوید کے قواعد اور اس کے درجہ بندی

سورہ قمر کی آیتوں کی درجہ بندی			
#	آیتوں کی درجہ بندی	تجوید کے قواعد	تجوید کے قواعد (تجوید کے قواعد)
سورہ قمر کی آیتوں کی درجہ بندی			
#	تجوید کے قواعد	تجوید کے قواعد	تجوید کے قواعد

نوٹ: سورہ قمر کی آیتوں کی درجہ بندی 20 آیتوں کی ہے اور اس کے قواعد درج ذیل ہیں۔

January 23, 2024

5 - تفریق

تفریق 3 (سہ ماہی) ارب کی رقم پر تفریق کی شرح اور سہ ماہی کی شرح

تفریق کی شرح اور سہ ماہی کی شرح کی شرح				
#	سہ ماہی کی شرح	تفریق کی شرح	سہ ماہی کی شرح	تفریق کی شرح

نوٹ: ہفت روزہ کی شرح سہ ماہی کی شرح 25 ارب کی رقم پر سہ ماہی کی شرح

6 - تفریق

تفریق کی شرح اور سہ ماہی کی شرح کی شرح

تفریق کی شرح	تفریق کی شرح اور سہ ماہی کی شرح	تفریق کی شرح
70	$70 \times \frac{\text{سہ ماہی کی شرح}}{\text{تفریق کی شرح}}$	70
10	$10 \times \frac{\text{سہ ماہی کی شرح}}{\text{تفریق کی شرح}}$	10
10	$10 \times \frac{\text{سہ ماہی کی شرح}}{\text{تفریق کی شرح}}$	10
10	$10 \times \frac{\text{سہ ماہی کی شرح}}{\text{تفریق کی شرح}}$	10
100		100

نوٹ: ہفت روزہ کی شرح سہ ماہی کی شرح 20 ارب کی رقم پر سہ ماہی کی شرح اور سہ ماہی کی شرح 100 ارب کی رقم پر سہ ماہی کی شرح

7 - ބަންދު

ބަންދުގެ ފޯމް

Form of Bid Security (Bank Guarantee)

WHEREAS,[name of Bidder] (hereinafter called "the Bidder") has submitted his Bid for the Tender no.....issued by the Ministry of Education onfor Supplying/Purchasing of[name of Contract] (hereinafter called "the Bid").

KNOW ALL PEOPLE by these presents that We [name of Bank] of [name of country] having our registered office at (hereinafter called "the Bank") are bound unto[name of Purchaser] (hereinafter called "the Purchaser") in the sum of *..... for which payment well and truly to be made to the said Purchaser, the Bank binds itself, its successors, and assigns by these presents.

SEALED with the Common Seal of the said Bank thisday of20.....

THE CONDITIONS of this obligation are:

- (1) If, after Bid opening, the Bidder withdraws his Bid during the period of Bid validity specified in the Form of Bid;
- or
- (2) If the Bidder having been notified of the acceptance of his Bid by the Purchaser during the period of Bid validity:
 - (a) fails or refuses to execute the Form of Agreement in accordance with the Instructions to Bidders, if required; or
 - (b) fails or refuses to furnish the Performance Security, in accordance with the Instruction to Bidders; or
 - (c) does not accept the correction of the Bid Price pursuant to Clause 27,

* The Bidder should insert the amount of the Guarantee in words and figures denominated in Maldivian Rufiyaa. This figure should be the same as shown in Clause 16.1 of the Instructions to Bidders.

we undertake to pay to the Purchaser up to the above amount upon receipt of his first written demand, without the Purchaser's having to substantiate his demand, provided that in his demand the Purchaser will note that the amount claimed by him is due to him owing to the occurrence of one or any of the three conditions, specifying the occurred condition or conditions.

This Guarantee will remain in force up to and including the date days after the deadline for submission of bids as such deadline is stated in the Instructions to Bidders or as it may be extended by the Purchaser, notice of which extension(s) to the Bank is hereby waived. Any demand in respect of this Guarantee should reach the Bank not later than the above date.

DATE..... SIGNATURE OF THE BANK

WITNESS SEAL

[signature, name, and address]

8 - ބަންދުކުރުމުގެ

ފޯމް ޖަހާނެ ޖަހާނެ

Form of Performance Bank Guarantee (Unconditional)

To:
[name & address of Purchaser]

WHEREAS [name and address of Supplier] (hereinafter called “the Supplier”) has undertaken, in pursuance of Contract No. dated to execute [name of Contract and brief description of Works] (hereinafter called “the Contract”);

AND WHEREAS it has been stipulated by you in the said Contract that the Supplier shall furnish you with a Bank Guarantee by a recognized bank for the sum specified therein as security for compliance with his obligations in accordance with the Contract;

AND WHEREAS we have agreed to give the Supplier such a Bank Guarantee;

NOW THEREFORE we hereby affirm that we are the Guarantor and responsible to you, on behalf of the Supplier, up to a total of * [amount of Guarantee] [amount in words], such sum being payable in the types and proportions of currencies in which the Contract Price is payable, and we undertake to pay you, upon your first written demand and without cavil or argument, any sum or sums within the limits of [amount of Guarantee] as aforesaid without your needing to prove or to show grounds or reasons for your demand for the sum specified therein.

*An amount is to be inserted by the Guarantor, representing the percentage of the Contract Price specified in the Contract, in Maldivian Rufiyaa.

We hereby waive the necessity of your demanding the said debt from the Supplier before presenting us with the demand.

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of the Works to be performed there under or of any of the Contract documents which may be made between you and the Supplier shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, or modification.

This Guarantee shall be valid until the date of issue of the Defects Correction Certificate.

SIGNATURE AND SEAL OF THE GUARANTOR

Name of Bank

Address

Date

9 - ބޭނުންކުރާ ގަވާއިދު

އަދަދުގެ ފުރިހަމަކުރުމަށް ފުރިހަމަކުރާ ބޭނުންކުރާ ގަވާއިދު

Form of Bank Guarantee for Advance Payment

To:

[name & address of Purchaser]

.....

.....

[name of Contract]

Gentlemen:

In accordance with the provisions of the Conditions of Contract, of the above-mentioned Contract, [name and address of Supplier] (hereinafter called "the Supplier") shall deposit with [name of Purchaser] a Bank Guarantee to guarantee his proper and faithful performance under the said Clause of the Contract in an amount of [amount of Guarantee] [amount in words].

We, the [Bank or Financial Institution], as instructed by the Supplier, agree unconditionally and irrevocably to guarantee as primary obligator and not as Surety merely, the payment to [name of Purchaser] on his first demand without whatsoever right of objection on our part and without his first claim to the Supplier, in the amount not exceeding * [amount of Guarantee] [amount in words].

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of Works to be performed there under or of any of the Contract documents which may be made between [name of Purchaser] and the Supplier, shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, or modification.

* An amount is to be inserted by the Bank or Financial Institution representing the amount of the Advance Payment, in Maldivian Rufiyaa.

This Guarantee shall remain valid and in full effect from the date of the advance payment under the Contract until [name of Purchaser] receives full repayment of the same amount from the Supplier.

Yours truly,

SIGNATURE AND SEAL:

NAME & ADDRESS OF BANK/INSTITUTION

٥ - مذكرات

مذكرات	
مذكرات	مذكرات
مذكرات	٣٣.١
مذكرات	٣٣.٢
مذكرات	٣٣.٣
مذكرات	٣٣.٤
مذكرات	٣٧

6. פירושים

א. פירושים

ב. הפירוש הנכון הוא: (ב) הפירוש הראשון, כי המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

הפירוש השני (א) מתייחס ל"עובד" ולא ל"הוא". לפיכך, המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

פירושים נוספים: (ב) הפירוש הראשון, כי המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

הפירוש השני (א) מתייחס ל"עובד" ולא ל"הוא". לפיכך, המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

1. ב. הפירוש הראשון, כי המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

הפירוש השני (א) מתייחס ל"עובד" ולא ל"הוא". לפיכך, המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

2. ב. הפירוש הראשון, כי המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

הפירוש השני (א) מתייחס ל"עובד" ולא ל"הוא". לפיכך, המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

3. ב. הפירוש הראשון, כי המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

הפירוש השני (א) מתייחס ל"עובד" ולא ל"הוא". לפיכך, המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

ב. הפירוש הראשון, כי המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

הפירוש השני (א) מתייחס ל"עובד" ולא ל"הוא". לפיכך, המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

ב. הפירוש הראשון, כי המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

הפירוש השני (א) מתייחס ל"עובד" ולא ל"הוא". לפיכך, המשפט "הוא עובד" מתייחס ל"הוא" ולא ל"עובד".

פירושים נוספים:	פירושים נוספים:
א.	א.
ב.	ב.
ג.	ג.
ד.	ד.

